

**M.A. Semester - 2 (CBCS) Examination
March/April -2019 (Old Course)**

THEORIES OF ECONOMIC DEVELOPMENT (INTERDISCIPLINARY/ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧	સમતોલ વિરૂદ્ધ અસમતોલ આર્થિક વિકાસની વ્યૂહરચના સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૧	આર્થિક વિકાસની વ્યાખ્યા આપી આર્થિક વિકાસમાં બજારતંત્રની ભૂમિકા સમજાવો.	
પ્રશ્ન-૨	આર્થિક વિકાસ અંગેનો Big pushનો સિદ્ધાંત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૨	માનવ વિકાસ આંક (H.D.I.)ની રચના પદ્ધતિ સમજાવો.	
પ્રશ્ન-૩	આર્થિક વિકાસનો પ્રશિષ્ટ સિદ્ધાંત સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૩	શુમ્પીટર દ્વારા રજૂ થયેલો આર્થિક વિકાસનો સિદ્ધાંત સમજાવો.	
પ્રશ્ન-૪	આર્થિક વિકાસમાં કૃષિક્ષેત્રનું મહત્વ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન-૪	આર્થિક વિકાસમાં ઔદ્યોગીક ક્ષેત્રનું મહત્વ સમજાવો.	
પ્રશ્ન-૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(૧) આર્થિક વિકાસ અંગે અમર્ત્ય સેનનો અભિગમ.	
	(૨) ભારતમાં ગરીબીનાં નિર્દેશકો.	
	(૩) કાલમાર્કસનો અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત.	
	(૪) વસ્તી અને આર્થિક વિકાસ અંગેનો સંબંધ.	

ENGLISH VERSION

Que-1	Explain the strategy of balanced Vs unbalanced economic development.	(14)
	OR	
Que-1	Define economic development and explain role of markets in economic development.	
Que-2	Explain Big Push theory of economic development.	(14)
	OR	
Que-2	Explain the creation formula of Human Development Index.	
Que-3	Explain the classical theory of economic development.	(14)
	OR	
Que-3	Explain the theory of economic development presented by Schumpeter.	
Que-4	Explain the significance of agricultural sector in economic development.	(14)
	Or	
Que-4	Explain the significance of industrial sector in economic development.	
Que-5	Write short notes. (any two)	(14)
	(1) Amarty Sen's approach to economic development.	
	(2) Indicators of Poverty in India.	
	(3) Theory of Surplus value of Karl Mark.	
	(4) Relation between population and economic development.	
